

➤ વેલ્યુ ઓફ સપ્લાય.

-કલમ-(૧૫) અને નિયમ ૨૭ થી ૩૫

-ટ્રાન્ઝેક્શન વેલ્યુ

શરતો

(૧) સપ્લાયર અને રીસીપિયન્ટ રીલેટેડ ન હોવા જોઈએ.

(૨) કિંમત જ સપ્લાય માટે એકમાત્ર કન્સીડરેશન હોય.

સપ્લાયની કિંમતમાં નીચેની રકમનો સમાવેશ થશે.:

(અ) સપ્લાયર દ્વારા સેન્ટ્રલ ટેક્સ, સ્ટેટ ટેક્સ, ઇન્ટીગ્રેટેડ ટેક્સ, સેસ, યુનિયન ટેરીટરી ટેક્સ સિવાયના અન્ય કાયદા અન્વયે કોઈપણ ટેક્સ, ડ્યુટી, સેસ, ફી કે ચાર્જનો બીલમાં જુદી ઉઘરાવેલ રકમનો.

(બ) કોઈપણ રકમ કે જેની ચુકવણીની જવાબદારી માલ અથવા સર્વિસના સપ્લાયરની હોય પરંતુ તેવી રકમ માલ અથવા સર્વિસ મેળવનારે ચુકવેલ હોય અને તેવી રકમનો સમાવેશ માલ અથવા સર્વિસના સપ્લાયરે બીલમાં કરેલ ન હોય તો તેવી રકમનો.

(ક) માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના બીલમાં કમીશન અને. પેકીંગ ચાર્જ સહિત ઉઘરાવેલ અન્ય ખર્ચા તેમજ માલ અથવા સેવા અથવા બંનેની ડીલીવરી કરતી વખતે અથવા તે અગાઉ કરેલ ખર્ચનો પણ સમાવેશ માલ અથવા સેવાની કિંમતમાં થશે.

(ખ) કોઈપણ સપ્લાયનું પેમેન્ટ મોડું કરવા બદલ ચુકવવામાં આવેલ વ્યાજ-લેઈટ ફી અથવા દંડની રકમનો.

(ગ) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસીડી સિવાયની માલ અથવા સેવા અથવા બંનેની કિંમત સાથે સીધી રીતે સંકળાયેલ સબસીડી, આવી સબસીડીનો સમાવેશ સબસીડી મેળવનાર સપ્લાયરની સપ્લાયની કિંમતમાં કરવામાં આવશે.

-કઈ બાબતોનો સમાવેશ થશે નહીં.

-ડીસ્કાઉન્ટ. જ્યારે માલ અથવા સેવા બંનેનો સપ્લાય કર્યા બાદ ડીસ્કાઉન્ટ આપવામાં આવેલ હોય ત્યારે કરારની શરતોથી પ્રસ્થાપિત થતું હોય તેમજ ચોક્કસ બીલના સબંધમાં આપવામાં આવેલ હશે તો તેનો સમાવેશ કિંમતમાં થશે નહીં.

➤ જીએસટી હેઠળ જોબવર્કની સરળ સમજૂતી:

- જીએસટી કાયદામાં જોબ-વર્કની વ્યાખ્યા કલમ-૨(૬૮) હેઠળ કરવામાં આવી છે. વિસ્તૃત જોગવાઈઓ કલમ-૧૪૩ અને નિયમ-૪૫માં થયેલ છે. વ્યાખ્યા અનુસાર કોઈ નોંધાયેલ કરપાત્ર વ્યક્તિના માલ ઉપર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા કે પ્રક્રિયા કરવામાં આવે તેને જોબવર્ક કહેવાય, પરંતુ જો એક નોંધાયેલ કરદાતા બીજી નોંધાયેલ વ્યક્તિને જોબવર્ક માટે માલ મોકલે તો તેવા સપ્લાય ઉપર નીચેની કેટલીક શરતોને આધિન જીએસટી લાગશે નહીં.:

શરતો:-

(૧) જ્યારે પણ કોઈ માલસામાન જોબવર્ક માટે મોકલવામાં આવે ત્યારે આવો માલ નિયમ-૫૫ માં જણાવ્યા પ્રમાણેના ડીલીવરી ચલનના આધારે મોકલવાનો રહેશે. આ જ રીતે જોબવર્ક દ્વારા પ્રિન્સિપાલને માલ પરત કરવામાં આવે ત્યારે તે ડીલીવરી ચલનના આધારે કરવાનો રહેશે.

(૨) નિયમ-૪૫ મુજબ જે ત્રિમાસિક હપ્તામાં જોબવર્કને માલ મોકલવામાં આવેલ હોય અથવા જોબ-વર્કર પાસેથી બીજા જોબ-વર્કરને માલ મોકલવામાં આવ્યો હોય તો તેની માહિતી તે ત્રિમાસિક હપ્તો પુરો થાય ત્યાર પછીના મહિનાની ૨૦ તારીખ સુધીમાં ઓન-લાઇન ફોર્મ GST ITC-04 માં આપવાની રહેશે.

(૩) જોબ-વર્કરને માલ જોબ-વર્ક માટે મોકલવોલ હોવા છતાં આવા માલ ઉપર ખરીદ બાજુએ ચૂકવેલ વેરાની મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રિન્સિપાલને મળશે.

(૪) જ્યારે માલની ખરીદી કરીને જોબ-વર્કરને આપવામાં આવે અથવા ખરીદેલો માલ વેચનાર દ્વારા સીધો જ જોબ-વર્કરને પહોંચાડવામાં આવે ત્યારે પ્રિન્સિપાલે જોબ-વર્કરને આવી રીતે મોકલેલ માલ સપ્લાય ગણીને વેરાપાત્ર થશે નહીં.